



SUNGOLD
CAPITAL LIMITED

CIN: L65910GJ1993PLC018956

31st May, 2022

To,
The General Manager,
Corporate Relation Department
Bombay Stock Exchange Limited
Phiroze Jejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai - 400001

SCRIP CODE: 531433

Sub: Copy of Advertisement published in Newspaper - Standalone Audited Financial Results for the Quarter and Year ended on March 31, 2022

Dear Sir/Madam,

Pursuant to the provision of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, enclosed copies of advertisement published in 'Lokmitra' Gujarati Edition and on 'Free Press Gujarat' English Edition, for Standalone Audited Financial Results of the Company for the Quarter and Year ended on March 31, 2022, which was reviewed by the Audit Committee and approved by Board of Directors at their meeting held on Monday, May 30, 2022.

Kindly take the same on your records and oblige.

Thanking You,

Yours Faithfully,

For Sungold Capital Limited


Shreya Shah
Company Secretary & Compliance Officer
Membership No: A59076



Encl: As Above

Registered Office Address:- House No.7/13, Opp White Tower, Station Road, Nandod, Rajpipla, Narmada - 393145

Corporate Office Address:- B/618, 6th Floor, Jaswanti Allied Business Centre, Off: Ramchandra Lane Extn, Kachpada, Malad - West, Mumbai 400064

☎ www.sungoldcapitallimited.com ☎ sungold2006@gmail.com | info@sungoldcapitallimited.com

☎ +91-8108756812 / 022-28891692

Arman Holdings Limited

Registered Office : 419, Rajhans Heights, Mini Bazar, Varachha Road, Surat- 395006.
Tel : 9586006569. Email ID : armanholdings@gmail.com. Website : www.armanholdings.in
CIN : L65993G11982PL082961

Extracts of Audited Standalone Financial Results for the Quarter and Financial Year ended 31/03/2022 (Amt Rs. in Lakhs)

Particulars	Quarter ended 31/03/2022	Quarter ended 31/03/2021	For the year ended 31/03/2022	For the year ended 31/03/2021
Particulars	(Unaudited)	(Unaudited)	(Audited)	(Audited)
Total income from Operations (net)	71.37	63.90	406.88	157.22
Net Profit from ordinary activities after tax	0.05	1.34	2.42	0.13
Net Profit for the period (after extraordinary items and Comprehensive Loss)	0.05	1.24	2.80	31.07
Paid-up equity share capital (Face Value of Rs.10/- each)	521.05	521.05	521.05	521.05
Reserve excluding Revaluation Reserves as per balance sheet #			139.66	136.74
Earnings Per Share before extraordinary items (of Rs.10/- each) (not annualised):				
(a) Basic	0.017	0.030	0.063	0.007
(b) Diluted	0.017	0.030	0.063	0.007
Earnings Per Share after extraordinary items (of Rs.10/- each) (not annualised):				
(a) Basic	0.017	0.030	0.063	0.007
(b) Diluted	0.017	0.030	0.063	0.007

Notes:
1. The above is an extract of the detailed format of quarterly/ annual audited financial results filed with the stock exchange under Regulation 33 SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of quarterly/ annual audited financial results are available on the Stock Exchange's website i.e., www.bseindia.com and also on the website of the company at www.armanholdings.in

For Arman Holdings Limited
Sd/-
Deepak Kumar Babel
Managing Director
DIN : 05200110

Date : 30/05/2022
Place : SURAT

NARMADA MACPLAST DRIP IRRIGATION SYSTEMS LTD

Regd. Office & Works : Plot No. 119-120, Santej-Vadnar Road, At Santej, Taluka : Kalol
Dist. Gandhinagar : 382721 Ph. No. 079-27498670

Audite Financial Results for the Quarter and Year ended on 31st March, 2022 (Rs. in Lacs)

Particulars	Quarter ended 31/03/2022	Quarter ended 31/03/2021	Quarter ended 31/03/2022	Quarter ended 31/03/2021
Particulars	Quarter ended 31/03/2022	Quarter ended 31/03/2021	Quarter ended 31/03/2022	Quarter ended 31/03/2021
Total income from operations	365.55	353.01	1,251.72	370.48
Net Profit / (Loss) from ordinary activities after tax	(17.98)	3.02	0.63	0.07
Total Comprehensive income for the period (Comprising profit for the period and Other Comprehensive income for the period) after tax	(17.98)	3.02	0.63	0.07
Equity Share Capital	362.30	362.30	362.30	362.30
Earnings Per Share (of Rs. 10/- each)				
Basic	(0.50)	0.08	0.02	0.00
Diluted	(0.50)	0.08	0.02	0.00

1. The above is an extract of the detailed quarterly results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full result of the Quarterly Results is available on the stock exchange website (www.bseindia.com).

FOR, NARMADA MACPLAST DRIP IRRIGATION SYSTEMS LTD
JITEN VRAJILAL VAGHASIA
WHOLE TIME DIRECTOR
(DIN : 02433557)

Place: Ahmedabad
Date: 30.05.2022

SIKKO INDUSTRIES LIMITED

CIN: L51909G2000PLC037329

Regd. Office: 508, Icon Elegance, Nr. Jain Temple, Nr. Prahladnagar Pick up Stand, Vejalpur, Ahmedabad - 380 051.
Phone: +91 79-66168950/66168951; E-mail: compliance@sikkoindia.com; Website: www.sikkoindia.com

AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2022 (Rs. in Lakh except EPS)

Particulars	Quarter ended 31/03/2022	Quarter ended 31/03/2021	Quarter ended 31/03/2022	Quarter ended 31/03/2021
Particulars	Quarter ended 31/03/2022	Quarter ended 31/03/2021	Quarter ended 31/03/2022	Quarter ended 31/03/2021
Total Income From Operations	1494.54	1300.99	1950.05	4157.24
Revenue from operations	(101.26)	106.83	80.22	261.01
Net Profit/(Loss) for the period before Tax, Exceptional and/or Extraordinary items	(101.26)	106.83	80.22	261.01
Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(73.23)	76.61	58.17	259.82
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period after tax and Other Comprehensive Income (after tax))	(73.23)	76.61	58.17	259.82
Equity Share Capital	1120.00	1120.00	1120.00	1120.00
Reserves, including Revaluation Reserve as per the audited Balance Sheet of Previous Year			99.97	809.26
Earnings Per Share (for continuing and discontinued operations)				
Basic	(0.65)	0.68	1.01	1.68
Diluted	(0.65)	0.68	1.01	1.68

Note:- The above is an extract of the detailed format of Audited Financial Results for the quarter and year ended on March 31, 2022 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the Audited Financial Results for the quarter and year ended on March 31, 2022 is available on the Website of Stock Exchange at www.bseindia.com as well as on the Company's website at www.sikkoindia.com.

For, Sikko Industries Limited
Sd/-
Jayantibhai Kumbhani
Managing Director(DIN: 00587807)

Date : May 30, 2022
Place: Ahmedabad

PATIDAR BUILDCON LIMITED

CIN: L99999G1989PTC058691

REGD. OFFICE: LATI BAZAR, JORAVARNAGAR, DIST. - SURENDRANAGAR, GUJARAT, INDIA - 363020.
www.patidarbuildconltd.in E-MAIL: patidarbuildconltd@rocketmail.com

EXTRACT FROM THE STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31.03.2022 (Amount in Lakh)

Sr. no.	Particulars	Quarter ended on 31st March, 2022	For the year ended on 31st March, 2022	Corresponding 3 Months ended on 31st March, 2021	For the previous year ended on 31st March, 2021
1	Total income from operations	36.40	181.41	80.44	161.99
2	Net Profit / (Loss) for the period before Tax, Exceptional and/or Extraordinary items	1.18	18.02	17.18	17.47
3	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	1.18	18.02	17.18	17.47
4	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period after tax and Other Comprehensive Income (after tax))	1.18	18.02	17.18	17.47
5	Equity Share Capital	530.05	530.05	530.05	530.05
6	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	144.33	144.33	128.56	128.56
7	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	0.02	0.29	0.25	0.29
8	Basic	0.02	0.29	0.25	0.29
9	Diluted	0.02	0.29	0.25	0.29

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.patidarbuildconltd.in)
2. The result of the Quarter ended on 31st March, 2022 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on May 3, 2022.

BY ORDER OF THE BOARD OF DIRECTOR
FOR, PATIDAR BUILDCON LIMITED
Sd/-

MR. RAJNIKANT PATEL
MG.DIRECTOR
DIN : 01218436

Date: 31-05-2022
Place: Ahmedabad

Ahmedabad's air more dangerous for infants, toddlers

AHMEDABAD: City's air pollution is emerging as a big threat to children's health. In a first-of-its-kind study on children below the age of six, researchers collated data from a public hospital to show how infants and toddlers suffer more than adults when exposed to particulate matter pollution (PM 2.5).

The 18-month-long study found that of the 12,635 paediatric admissions, 2,682 children below six years of age - almost 21% - had reported respiratory disorders and infections due to air pollution. The WHO has prescribed minimum exposure of toddlers and infants to particulate matter pollution of the order of 15 microgram per cubic metre (of PM 2.5). But children are exposed to three or sometimes five times PM 2.5 pollution even when

Central Pollution Control Board (CPCB) norms are met, thus putting them at a greater risk of PM 2.5. It is time that the state and the Centre evolve a strategy to include children when designing pollution standards. Kids are our future, and the government should encourage research on mitigating pollution and investigating how it affects our children.

The study was led by Dr Khyati Kakkad of AMC Medical Education Trust Medical College and LG hospital along with Chirantap Oza, a paediatrician. Joining them were Priya Dutta from IPH-Gandhinagar, Varsha Chorshiya from School of Physiotherapy, Delhi University, and Prashant Rajput from Public Health Foundation of India, Gurugram. The study found

that around 30.6% of the 2,682 children were exposed to particulate pollution. Another 74.83% lived at a distance of less than 500 metres from the main road, thus exposing them to vehicle fumes; around 11.59% of children were affected by indoor air pollution.

Out of 2,682 respiratory admissions, 1612 (60.1%) were experiencing "wheezing disorders" while 1,070 (39.9%) were diagnosed with "non-wheezing disorders". The study noted, "Infants and young children have less complete lungs, a larger proportion of small



airways, weaker chest wall and less immature immune system. These make them more vulnerable to respiratory diseases." Another interesting fact emerged from the study was according to WHO recommendation, young

infants or toddlers must not be exposed to particulate pollution levels of PM 2.5 exceeding 15 micrograms per cubic metre. However, the annual average PM2.5 concentration in Ahmedabad was 80.27 micrograms per cubic metre.

Junagadh cop feted for probe



Rajkot: Junagadh district's deputy superintendent of police, Pradeepsinh Jadeja, was awarded a medal for excellent investigation in a double murder case of Bhavnagar by Union home minister Amit Shah at function in Nadiad on

Sunday. In October 2012, the Nilambaug police of Bhavnagar city had lodged an offence after a woman named Sangeeta Pande and her 11-year-old son were found murdered. Jadeja was police inspector of A-division at that time

19-year-old held for caretaker's murder

Rajkot: Rajkot crime branch on Saturday arrested a 19-year-old youth from his native place in Rajasthan for allegedly killing the 68-year-old caretaker of a bungalow on the path Amin Marg in the city. The accused had worked at the bungalow earlier and knew the victim well. The police arrested Anil Meena from Bhora village under Semari taluka in Udaipur district based on specific information and technical surveillance. He had allegedly killed Vishnu Guchala by throttling him on Tuesday night. Guchala was the caretaker at the bungalow owned by businessman Pravin Patel who lives in Vadodra. Rajkot police commissioner Raju Bhargava told TOI, "He was working here before. However, he had no gain out of this murder. We have just brought him and are conducting an interrogation." According to police, Meena was working at Patel's farmhouse for a couple of months and he had been called to do some cleaning work at the bungalow during Diwali festival. He knew that an amount of Rs 40,000 to Rs 50,000 always remained with Guchala who was authorised to pay the salary to those people working

at the bungalow. "On Tuesday night, he entered the bungalow with the intention of theft. There was no other staff member inside the bungalow at that time. Guchala spotted Meena stealing the money and he resisted. Meena got scared, so he strangled Guchala. Then, out of fear, Meena left the place without taking any money," said police. After leaving the bungalow, Meena walked towards Kotecha Chowk, from where he took an auto and went to GRTC bus stand. Then he took a bus to Ahmedabad, where he got down around 3am near Iscon circle. There he took another vehicle to go to Rajasthan. He was captured on CCTV and the investigators checked several footages to track his movement.

Patel's neighbour Ravi had seen Meena running from the bungalow and he had confronted him. He had talked to him in Hindi. Ravi had immediately informed Patel about something "suspicious happening at the bungalow". Then Patel called Guchala's son and his other staff members and asked them to go to the bungalow. When they reached the bungalow, they found that Guchala was already dead.

Bhupendra Patel to hear applicants in 'Rajya-Swagat' programme in Gandhinagar

AHMEDABAD: Chief minister Bhupendra Patel will be present at the state-level online public grievance redressal programme to be held on Thursday, May 26, 2022, in Gandhinagar. The applicant's grievances will be heard by CM and necessary action for proper solutions to their problems will be taken up. This state-wide attention on public grievances by application of technology (Swagat) program to address the grievances of the citizens of the state through conversations and guidance through grievances technology has been started by the Prime Minister Narendra Modi during his visit to Gandhinagar of Gujarat in 2003. Under this program, the chief minister listens directly to the complaints and grievances of the citizens at the Swagat held on the fourth Thursday of every month. Accordingly, chief minister Bhupendra Patel will conduct this program in the newly constructed reception room with huge seating capacity equipped with advanced technology-facilities on the ground floor of Swarnim Sankul-II. The state level Swagat program is to be held on Thursday. Taluka level Swagat online public grievance redressal program is held on the fourth Wednesday of the month and district Swagat is held on the fourth Thursday morning. CM will also guide the participating district officers through video conferencing from the district level after the state Swagat program. Under this program, the chief minister listens directly to the complaints and grievances of the citizens at the Swagat held on the fourth Thursday of every month.

SUNGOLD CAPITAL LTD

[CIN: L65910G1993PLC018956]

Regd. off: House no. 7/13, opp White Tower, Station Road, Nandod, Rajpipla Narmada - 393145.
Corporate Off: B/618, 6th Floor, Jasvanti allied Business Centre, off: Ramchandra Lane extn, Malad (west), Mumbai - 400064
Website: www.sungoldcapitallimited.com | Email: info@sungoldcapitallimited.com

STATEMENT OF AUDITED FINANCIAL RESULT FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2022 (Rs. in Lakhs, except per share data)

Sr. no.	Particulars	Quarter ended 31-03-2022	Year ending 31-03-2022	Year ending 31-03-2021	Three months ended in the previous year
1	Total Income from Operations	1,35,971	4,83,4	1,35,971	46,681
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(4,876)	4,834	(4,876)	(5,894)
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	(4,876)	4,834	(4,876)	(5,894)
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(4,272)	3,617	(4,272)	(4,361)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period after tax and Other Comprehensive Income (after tax))	(4,272)	3,617	(4,272)	(4,361)
6	Equity Share Capital (Face value of Rs. 10/-)	1840.350	1840.350	1840.350	1840.350
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year		364.450		-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)				
(a) Basic		-0.023	0.020	-0.023	-0.024
(b) Diluted		-0.023	0.020	-0.023	-0.024

NOTES:
The above result is reviewed by the Audit Committee at the meeting and approved by the Board of Directors at their meeting held on Monday, 30th May, 2022. The above is an extract of the detailed format of financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulations, and 2015. The full format of financial Results is available on Stock Exchange website www.bseindia.com and on Company's website www.sungoldcapitallimited.com. The Company has three reportable segments which are NBFC, Entertainment and software development.

For Sungold Capital Limited
Sd/-
Rajiv Kotia
(Chairman & Managing Director)
DIN: 00135912

Place : Mumbai
Date : 30.05.2022

CRESTCHEM LIMITED

CIN: L24100G1991PLC015530

Regn Office Address: Sc. No.550/1, Sub Plot No. 12, Village- Indrad, Taluka- Kadi, Mahesana- 382715

STATEMENT OF STANDALONE UN AUDITED/ AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2022 (Rs in Lacs)

Sr. No.	Particulars	Quarter ended 31.03.2022	Quarter ended 31.12.2021	Quarter ended 31.03.2021	Year ended 31.03.2022	Year ended 31.03.2021
1	Income					
a)	Revenue from operations	378.66	266.80	253.65	794.73	764.17
b)	Other Operating Income					
a)	Total Income from Operations (net)	378.66	266.80	253.65	794.73	764.17
b)	Other Income	2.54	0.82	1.59	5.61	1.62
c)	Total Income (a+b)	381.20	267.60	255.24	800.34	765.79
2	Expenses					
a)	Cost of Material Consumed	288.07	211.18	185.06	612.94	581.52
b)	Purchase of Stock-in-Trade					
c)	Changes in Inventories of Finished Goods, Work-in-progress and stock-in-trade	0.29	0.25	0.16	0.06	0.32
d)	Employee Benefits expense	9.10	7.01	30.43	26.21	46.54
e)	Finance Costs	0.10	0.83	0.23	1.58	1.61
f)	Depreciation & amortization expenses	0.65	0.65	0.67	2.60	2.49
g)	Other Expenses	45.70	12.41	8.07	80.76	69.88
h)	Total Expenses (a+b+c+d+e+f+g)	343.90	236.92	225.12	724.14	702.26
3	Profit before Tax (1-2)	37.29	31.68	30.12	78.12	67.33
4	Tax Expenses					
a)	Current Tax	11.18	9.41	0.78	22.02	10.51
b)	Deferred Tax	(1.20)	0.73	1.80	(0.62)	(0.59)
5	Profit for the period (3-4)	9.08	10.14	2.54	21.40	9.92
6	Less: Non Controlling Interest	27.31	21.54	27.58	56.72	57.41
7	Net Profit after Non Controlling Interest (5-6)	(2.86)	(2.86)	(2.86)	(2.86)	(2.86)
8	Other Comprehensive Income					
a)	Total comprehensive income for the period (5+6)	27.31	21.54	27.54	56.72	57.41
9	Paid-up Equity share Capital-Face Value of '10	300.00	300.00	300.00	300.00	300.00
10	Earnings per equity share (EPS) in (not Annualised)					
a)	BASIC	0.91	0.72	0.92	1.89	1.91
b)	DILUTED	0.91	0.72	0.92	1.89	1.91

Notes:
(I) The above Audited Financial Results for the Quarter ended March 31, 2022 and for the year ended March 31, 2022 have been reviewed by the Audit Committee and were taken on record by the Board of Directors in their respective meetings held on May 30, 2022 and review of the same has been carried out by the Statutory Auditors of the Company.
(II) The results for the quarter and year ended 31st March, 2022 were audited by Statutory Auditor of the Company.
(III) The audited standalone financial results are prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as prescribed under Section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and Companies (Indian Accounting Standards)(Amendment) Rules, 2016 and other recognised practices and policies to the extent applicable.
(IV) Segment reporting as defined in Ind AS 108 is not applicable, since the Company has only one business segment i.e. Petrochemical Industries. Further, the company does not have any subsidiary/ associate.
(V) "Due to outbreak of COVID-19 globally and in India, the company's management has made initial assessment of likely adverse impact on business and financial risks, and believes that the impact is likely to be short term in nature. The management does not see any medium to long term risks in the company's ability to continue as a going concern and meeting its liabilities as and when they fall due." The Management based on current estimates expects that the carrying amounts of Receivables, Inventories & Advances will be recovered, net of provisions made. The extent to which the COVID-19 pandemic will impact the company's financial performance is dependent on future developments, which are highly uncertain including among other things, any new information concerning the severity of the COVID-19 pandemic and any action to contain its spread or mitigate its impact to the economy. Management is not able to estimate the extent to which the uncertainty over the potential macro-economic conditions the impact of COVID-19 pandemic may be different from that estimated at the date of approval of these financial statements and the company will continue to closely monitor any material changes to future economic conditions, which will be given effect to in the respective future period."
(VI) Figures for the previous year have been regrouped, recast and rearranged, wherever necessary.
(VII) Figures for the quarter ended 31st March, 2022 and 31st March, 2021 are the balancing figures between audited figures for the full financial year and the reviewed year to date figures upto the third quarter of the respective financial years.

By order of Board of DirectorsFor
Crestchem Limited
Sd/-
Dipak Patel
Managing Director
(DIN - 02052080)

Place : Indrad, Kadi
Date : 30th May, 2022

